

સેકન્ડરી સ્ક્રિપ્ટ:

તમે 'સ્કૂલ મેસેન્જર સ્કૂલ ટેલિફોન પ્રિ-રજિસ્ટ્રેશન'નો જે કોલ અંગ્રેજીમાં મેળવવાના છો તેનું આ (ગુજરાતી) ભાષાંતર છે.

આ સપ્ટેમ્બરમાં તમારા બાળકને ગ્રેડ (બાળક માટે વિશિષ્ટ)માં જવા માટે ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડનો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ છે. (તમને તમારા દરેક બાળક માટે એક ફોન કોલ આવશે. કોલ્સ તેઓ જે ગ્રેડમાં હાજર રહેતા હશે તે દ્વારા ઓળખવામાં આવશે.)

શિક્ષણ મંત્રાલયે જાહેર કર્યું છે કે માધ્યમિક શાળાઓ અનુકૂળ કરવામાં આવેલ મોડેલ સાથે અને આરોગ્ય અને સલામતીનાં ઊચ્ચ પગલાં સાથે ખુલશે. ટીડીએસબીમાં, વિદ્યાર્થીઓ દર બીજા દિવસે આશરે 15 વિદ્યાર્થીઓના નાના વર્ગના કદમાં રૂબરૂ શાળામાં ભાગ લેશે; ઘરે શીખવાનું ચાલુ રાખશે, જેમાં સ્વતંત્ર કામના સમય અને લાઇવ ઓનલાઇન શિક્ષણ બંનેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, માધ્યમિક શાળાઓ ક્વોડમેસ્ટર શિડ્યુલ પર કાર્ય કરશે જે શાળા વર્ષને દરેક 44 દિવસના ચાર બ્લોકમાં વહેંચે છે અને જ્યાં વિદ્યાર્થીઓ દરેક ક્વોડમેસ્ટરમાં બે અભ્યાસક્રમો લે છે.

જો તમે સપ્ટેમ્બરમાં તમારા બાળકને રૂબરૂ શિક્ષણ માટે શાળામાં ન મોકલવાનું પસંદ કરો છો, તો દૂરસ્થ શિક્ષણ -રિમોટ લર્નિંગ- માટે ટીડીએસબીની વર્ચ્યુઅલ સ્કૂલ દ્વારા તમારા બાળક માટે સંપૂર્ણ રીમોટ લર્નિંગ મોડેલ ઘરે ઉપલબ્ધ હશે. દૂરસ્થ શિક્ષણ સેન્ટ્રલ વર્ચ્યુઅલ સ્કૂલ મોડેલ દ્વારા પહોંચાડવામાં આવશે કારણ કે દરેક શાળા આધારિત મોડેલ માટે પૂરતા પ્રમાણમાં સ્ત્રોતો નથી.

તમારી શાળાએ સપ્ટેમ્બર માટે વર્ગની યાદીઓ બનાવવાની આવશ્યકતા છે, તેથી અમે તમને હાલના સમયે તમારા બાળકને રૂબરૂમાં (આનો અર્થ થાય છે શાળામાં રૂબરૂ) માટે અથવા રિમોટ લર્નિંગ (આનો અર્થ વર્ચ્યુઅલ સ્કૂલ) માટે નોંધાવવા જણાવીએ છીએ.

1) તમારું બાળક સપ્ટેમ્બરમાં શાળામાં કેવી રીતે પરત આવશે:

"મારું બાળક વ્યક્તિગત રૂપે રૂબરૂમાં હાજરી આપશે" માટે 1 દબાવો

"મારું બાળક રિમોટ લર્નિંગ માટે વર્ચ્યુઅલ સ્કૂલમાં ભણશે" માટે 2 દબાવો

તમારી નોંધણી બદલ આભાર. આગળનાં પગલાં વિશે અપડેટ્સ અને માહિતી મેળવવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટ www.tdsb.on.ca ની મુલાકાત લો.